

3 GUJARAT

VADODARA

TOBACCO WORTH Rs 1 CR SEIZED

Vadodara police seized tobacco worth Rs 1 crore from a truck bearing a registration number of Rajasthan. The police raided godowns allegedly belonging to a Padra taluka resident but learnt that the owner was based abroad.

PRODUCTS WORTH RS 50.28 CR SEIZED FROM HIMACHAL, TOO

Chinese toys worth Rs 64 cr caught at Mundra, form 90% of seizures by EC in Gujarat

AVINASH NAIR
AHMEDABAD, NOVEMBER 11

CHINESE TOYS worth Rs 64 crore has been seized from Mundra port in Gujarat and make up 90 per cent of total seizures made so far by the Election Commission which is enforcing the Model Code of Conduct (MCC) in the poll-bound state.

"Total items worth Rs 71 crore have been seized so far. This includes Rs 64 crore of freebies which fall in the category of other items, under which DRI has seized from Mundra port Chinese toys worth Rs 64 crore," said Kuldeep Arya, additional chief electoral officer.

When asked if these toys were meant for any political party, Arya added, "It is not clear if the toys are directly related to the elections. It is currently being investigated."

Election Officials later said that apart from DRI, the Central Board of Indirect Taxes and Customs have also apprehended similar consignment of toys.

"There has been a seizure of toys on Friday too. However, the worth of the seizure will be revealed later," the official added. On Friday, Election Commission issued a press note in Delhi on the "record seizures" made in Gujarat and Himachal Pradesh.

"As a drive, the results are encouraging with Gujarat witnessing seizures of Rs 71.88 crore in just few days of announcement

of elections which surpasses even the seizures made in entire duration of enforcement of Model Code of Conduct in assembly elections 2017 which was Rs 27.21 crore."

The EC release stated that the "toys and accessories" seized from Mundra port were being smuggled by way of misdeclaration and by resorting to concealment in import cargo.

Two persons including the mastermind has been arrested in this case, the release added.

The EC officials in Gujarat said Friday that between November 3 and 11, a total of 10,150 cases have been filed under the Gujarat Prohibition Act and 8,346 people have been arrested.

Under the Act, Rs 10 crore of items have been seized which includes Rs 4.05 crore of IMFL and Rs 8.38 lakh of country-made liquor.

Under the Arms Act 1959, 26 illegal weapons and 49 cartridges have been seized by the police. Similarly, under the NDPS Act, 17 cases have been filed and Rs 1.01 crore of narcotic substances have

been seized. The 1,638 static surveillance teams, 586 flying squads and 140 inter-state check posts have 86.56 lakh worth of cash and ornaments have been seized. Five cases have been filed in Valsad, Ahmedabad city, Bharuch and Surat city where Rs 48.83 lakh cash and Rs 38.73 lakh ornaments have been seized.

Till now, 85.6 per cent of the weapons with permit in the state have been deposited and since November 3, a total of 16,305 non-bailable warrants have been executed.

Meanwhile, authorities in Himachal Pradesh made seizures worth Rs 50.28 crore, of which Rs 17.18 crore was in cash. Liquor worth Rs 17.50 crore, which amounts to 9.72 lakh litres, drugs worth Rs 1.20 crore, precious metals worth Rs 13.99 crore and other freebies worth Rs 41 lakh were also seized in the hill state.

During the 2017 elections, authorities made seizures worth Rs 9.03 crore.

WITHINPUS FROM
ENS, DELHI



TEARY TRIBUTE

A follower gets emotional as she shares her memories about Elaben Bhatt, noted Gandhian and founder of the Self-Employed Women's Association (SEWA), during a memorial prayer meet held in Ahmedabad on Friday. Bhatt passed away on November 2 at the age of 89. *Nirmal Harindran*

WAIVES OFF BAIL CONDITION UNTIL NOV 2023

Relief for Hardik, HC allows him to enter Mehsana dist

EXPRESS NEWS SERVICE
AHMEDABAD, NOVEMBER 11

IN A major relief, the Gujarat High Court Friday granted temporary relaxation of a bail condition to Viramgam BJP candidate Hardik Patel that barred him from entering the limits of Mehsana. The court of Justice SH Vora granted the relaxation for a year until November 2023.

Hardik had submitted that when the bail condition was imposed the trial was pending before the court for rioting and arson in a 2015 FIR related to the Patidar agitation. He was later convicted and sentenced to two years' of imprisonment in July 2018 by a Visnagar court in the case.



Hardik Patel is BJP candidate from Viramgam. File

However, the HC, in August 2018, suspended the sentence. Currently, his appeal against the conviction remains pending before the HC.

In April, the Supreme Court suspended the conviction order. Hardik also submitted through

his advocate Rafik Lokhandwala that he is a BJP member and has been given candidature by the BJP to contest the Assembly elections, and will be required to travel frequently across Gujarat, including Mehsana, for "campaigning and fulfilling the political obligation cast upon him."

It was also submitted that the temple of Umiya Mataji is situated in Mehsana's Unjha and due to the "harsh condition" of the bail, Hardik has been "unable to attend social and religious functions, even though he has been invited on a number of occasions."

Hardik has also moved an application for temporary deletion of the condition that remains pending before the HC, and is expected to be taken up next in January 2023.

NATIONAL LAW UNIVERSITY ODISHA, CUTTACK
(Established by Odisha Act IV of 2009)
Kathajodi Campus, Sector 13, CDA, Cuttack-753015, Odisha
[Accredited with 'A' Grade by NMAC]

FIRST DINABANDHU SAHU MEMORIAL PUBLIC LECTURE (ONLINE) ON 13TH NOVEMBER 2022 (SUNDAY)

National Law University Odisha is organising the First Dinabandhu Sahu Memorial Public Lecture (Online) on 13th November 2022 (Sunday) at 11:30 am on Google Meet. The lecture will be delivered by J. Dipak Misra, the former Chief Justice of India, on the theme of "Personal Liberty and Dignity under the Constitutional Framework" to commemorate the contributions of Late Shri Dinabandhu Sahu. Please visit www.nluo.ac.in for further details.
Sd/- Registrar (I/c)

Madhusudan Industries Ltd.
Regd. Office: Survey No. 359/B, 359/C, 361 & 362, Rakhai-382315 Tal. Dangan, Dist. Gandhinagar, Gujarat
Ph: 079-26427287 Email: madhusudan_i@yahoo.in Website: www.madhusudan-india.com CIN: L29199GJ1945PLC000443

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30th SEPTEMBER, 2022
(Rs. In Lakhs)

Sr. No.	Particulars	Quarter ended			Half Year ended		
		30.09.2022	30.09.2022	30.09.2021	30.09.2022	30.09.2022	30.09.2021
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)
1	Total Income from Operations	29.10	57.27	26.91			
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	283.00	118.71	201.54			
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and / or Extraordinary items)	283.00	118.71	201.54			
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and / or Extraordinary items)	197.79	89.96	151.09			
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	197.41	89.19	151.31			
6	Equity Share Capital (Face value of Rs.5/- each)	268.75	268.75	268.75			
7	Other Equity (Excluding revaluation reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-			
8	Earnings per equity share (of Rs.5/- each) (Not annualised):						
	(1) Basic (Rs.)	3.68	1.67	2.81			
	(2) Diluted (Rs.)	3.68	1.67	2.81			

Notes:
1 The above is an Extract of the detailed format of financial results for quarter and half year ended on 30th September, 2022 filed with the Stock Exchange under Regulation - 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited financial results for the quarter and half year ended 30th September, 2022 are available on the website of the Stock Exchange (www.bseindia.com) and the Company's website (www.madhusudan-india.com).
2 Figures of the previous periods have been regrouped/ reclassified/ restated wherever necessary.
3 The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meetings held on 11th November, 2022.

By Order of the Board of Directors
For, Madhusudan Industries Limited
Rajesh B. Shah
Chairman (Non-Executive Director)
(DIN: 00607602)

Date: 11th November, 2022
Place: Ahmedabad

VADILAL CHEMICALS LIMITED
Regd. Office: 503-504, Aditya Building, Nr. Sardar Patel Seva Samaj, Mithakhali, Navrangpura, Ahmedabad-380006
Email: info.vcl@vadilalgroup.com
CIN : L24231GJ1991PLC015390

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ON 30-09-2022
(Rs. In Lacs except per share data)

Particulars	Quarter ended on 30-09-2022		Corresponding three months ended on 30-09-2021 in the previous year
	Current Year cumulative upto 30-09-2022 (6 months)	30-09-2022	
	(Unaudited)	(Unaudited)	
Total income from operations (net)	2107.21	4470.15	1684.39
Net Profit for the Period before tax, Exceptional Items/ Extraordinary Items	112.63	315.78	114.87
Net Profit for the period before tax	112.63	315.78	114.87
Net Profit for the period after tax	81.41	233.94	85.35
Total Comprehensive Income for the Period	79.58	231.70	81.97
Equity Share Capital	487.40	487.40	487.40
Earnings Per Share (of Rs. 10 each)			
Basic :	1.67	4.80	1.75
Diluted:	1.67	4.80	1.75

Notes :
1) The above is an extract of the detailed format of Unaudited Financial Results of the Company for the quarter and half year ended on 30-09-2022 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results for the quarter and half year ended on 30-09-2022 are available on Company's website viz www.vadilalchemicals.in
2) The above Unaudited Financial results have been approved by the Board of Directors at its Board Meeting held on 11th November, 2022 and Limited Review of the above results have been carried out by statutory auditor of the company.

FOR VADILAL CHEMICALS LIMITED
Sd/-
RAJESH R. GANDHI
CHAIRMAN & MANAGING DIRECTOR

Date : 11th November, 2022
Place: Ahmedabad

SHILP GRAVURES LIMITED
Regd. Office: 778/6, Pramukh Industrial Estate, Sola-Santaj Road, Village Rakanpur, Tal. Kalol, Dist. Gandhinagar, Gujarat - 382 722, India.
Ph. No.: 02764 - 286323/24, Fax No.: 02764 - 286335 Website: www.shilpgravures.com Email: purvipatel@shilpgravures.com CIN: L27100GJ1993PLC020552

STATEMENT OF FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30th SEPTEMBER, 2022
(Rs. In Lakhs)

Sr. No.	Particulars	Standalone						Consolidated					
		Quarter ended		Half Year ended		Year ended		Quarter ended		Half Year ended		Year ended	
		30.09.2022	30.06.2022	30.09.2021	30.09.2022	30.09.2021	31.03.2022	30.09.2022	30.06.2022	30.09.2021	30.09.2021	31.03.2022	31.03.2022
1	Total Income	2036.25	2,005.24	1916.09	4041.49	3709.13	7,172.88	2316.11	2235.37	2099.90	4551.48	4054.39	7,851.24
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	424.12	171.94	332.57	596.06	653.30	1,116.18	436.87	178.22	303.58	615.09	604.15	1,006.54
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	424.12	171.94	332.57	596.06	653.30	1,116.18	436.87	178.22	303.58	615.09	604.15	1,006.54
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	383.64	80.54	254.52	464.18	550.32	870.04	393.57	83.73	233.30	477.29	514.52	791.18
5	Total Comprehensive income for the periods	385.23	85.00	262.87	470.23	556.57	888.96	395.16	88.19	241.65	483.34	520.77	805.02
6	Equity share capital (Face Value of Rs 10.00/- each)	614.98	614.98	614.98	614.98	614.98	614.98	614.98	614.98	614.98	614.98	614.98	614.98
7	Reserve and Surplus	-	-	-	-	-	7,534.18	-	-	-	-	-	7,399.85
8	Earnings Per Share (EPS) (of Rs. 10 Each) (Not annualized for Quarters)												
i	a) Basic and Diluted	6.24	1.31	4.14	7.55	8.95	14.15	6.40	1.36	3.79	7.76	8.73	12.87
ii	b) Basic and Diluted	6.24	1.31	4.14	7.55	8.95	14.15	6.40	1.36	3.79	7.76	8.73	12.87

Notes:
1 The above unaudited standalone / consolidated financial results for the quarter and half year ended 30th September 2022 have been reviewed by the Audit committee and subsequently approved by the Board of Directors in their respective meetings held on 10th November 2022. These unaudited standalone / consolidated financial results have been subjected to Limited review by the statutory auditors of the company. The statutory auditors have expressed an unmodified conclusion.
2 The above Standalone and Consolidated Financial Results have been prepared in accordance with the guidelines issued by the Securities and Exchange Board of India ("SEBI") and the Indian Accounting Standards (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013.
3 The Company has not elected to exercise its option permitted U/S 115BAA of the Income tax act, 1961 and provision of current tax has been made as per the normal provisions of the Income Tax Act, 1961 and rules frame there under.
4 Other income includes net gain arising on sale of investment Rs. 30.99 Lacs and Rs. 117.03 Lacs for the half year ended 30th September 2022 and 30th September 2021 respectively and net gain arising on investments measured at FVTPL amounting Rs. NIL and Rs. 158.78 Lacs for the half year ended on 30th September 2022 and 30th September 2021 respectively. Further, Other expenses includes loss arising on investment measured at FVTPL Rs. 52.84 Lacs and Rs. NIL for the half year ended on 30th September 2022 and 30th September 2021 respectively.
5 The Figures of previous periods have been regrouped / reclassified, wherever necessary, to make them comparable.
6 The code on Social Security 2020 ('Code') relating to employee benefits during the employment and post employment benefits received Presidential accent in September 2020. The Code has been published in official gazette of India. The effective date from which the Code is applicable yet not notified. The Company will assess the impact of the Code when it comes to effects and will record any related impact in the period of the Code become effective.
7 As per requirements of Regulation 33 of the Securities and Exchange Board of India, the Company is required to publish financial results. The financial results are available for perusal on the Company's website www.shilpgravures.com as well as on the stock exchange websites www.bseindia.com.

Place: Rakanpur
Date: 10th November, 2022

For, Shilp Gravures Limited
Sd/-
Mr. Ambar Patel
Managing Director
(DIN: 00050042)

THDC INDIA LIMITED
(श्रीक, मिनी रत्न उपक्रम)
(Schedule-A, Mini Ratna PSU)
CIN : U45203UR1988GOI009822

[Regulation 52 (8), read with Regulation 52 (4) of the SEBI (Listing obligations and Disclosure Requirements) Regulations, 2015 (LODR Regulations)]
(Rs. in Crore)

S. No.	Particulars	Standalone						Consolidated					
		Quarter ended		Six Months ended		Year ended		Quarter ended		Six Months ended		Year ended	
		30.09.2022	30.09.2021	30.09.2022	30.09.2021	31.03.2022	30.09.2022	30.09.2021	30.09.2022	30.09.2021	31.03.2022	31.03.2022	
1	Total Income from Operations	589.26	702.53	923.21	1018.80	2227.34	589.30	702.55	923.27	1018.87	2227.44		
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	288.43	453.28	321.21	505.96	1149.41	288.24	453.30	320.78	506.03	1147.94		
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	288.43	453.28	321.21	505.96	1149.41	288.24	453.30	320.78	506.03	1147.94		
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	262.79	370.69	320.70	418.27	894.78	262.70	370.71	320.49	418.34	893.74		
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	264.41	369.89	323.95	417.03	896.92	264.32	369.91	323.74	417.10	895.88		
6	Paid up Equity Share Capital	3665.88	3665.88	3665.88	3665.88	3665.88	3665.88	3665.88	3665.88	3665.88	3665.88		
7	Reserves (excluding Revaluation Reserve)	6766.28	6477.74	6766.28	6477.74	6640.27	6765.17	6477.60	6765.17	6477.60	6639.31		
8	Securities Premium Account	-	-	-	-	-	-	-	-	-	-		
9	Net worth	10432.16	10143.62	10432.16	10143.62	10306.15	10431.05	10143.48	10431.05	10143.48	10305.19		
10	Paid up Debt Capital/ Outstanding Debt	9038.97	6480.59	9038.97	6480.59	7080.61	9038.97	6480.59	9038.97	6480.59	7080.61		
11	Outstanding Redeemable Preference Shares	-	-	-	-	-	-	-	-	-	-		
12	Debt Equity Ratio	0.96	0.67	0.96	0.67	0.78	0.96	0.67	0.96	0.67	0.78		
13	Earnings Per Share (of ₹1000/-each) (for continuing and discontinued operations) -												
	1. Basic:	71.68	101.12	87.48	114.10	244.08	71.67	101.12	87.44	114.11	243.88		
	2. Diluted:	71.68	101.12	87.48	114.10	244.08	71.67	101.12	87.44	114.11	243.88		
14	Capital Redemption Reserve	-	-	-	-	-	-	-	-	-	-		
15	Debtenture Redemption Reserve	156.25	103.75	156.25	103.75	128.00	156.25	103.75	156.25	103.75	128.00		
16	Debt Service Coverage Ratio	2.34	2.89	1.72	1.91	1.98	2.33	2.88	1.72	1.91	1.97		
17	Interest Service Coverage Ratio	6.35	14.05	4.53	8.78	9.93	6.35	14.05	4.53	8.78	9.92		

- Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind AS Rules / AS Rules, whichever is applicable.

Notes:
1. The above results have been approved by the Board of Directors at their meeting held on 10.11.2022.
2. The above is an extract of the detailed format of Unaudited Half Yearly Financial Results filed with the Stock Exchanges under Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Half Yearly Financial Results is available on the stock exchange websites, www.nseindia.com and www.bseindia.com and can be accessed on the <https://www.bseindia.com/xml-data/corpfilling/AttachLive/b7fe5c29-965c-4d71-b05b-b2eac0bd6bb2.pdf> and https://archives.nseindia.com/content/debt/WDM/Debt_10112022201319_FinancialStatement.pdf
3. For the other line items referred in regulation 52(4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, pertinent disclosures have been made

પીપાવાવ પોર્ટ ભારતમાં ખાનગી ક્ષેત્રે વીએલસીએસ માટેની સવલત વિકસાવશે

નવન દલે અમદાવાદ, તા. ૧૧ એપ્રિલ ૨૦૨૨

પીપાવાવ (ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ) જે ખાનગી સેક્ટરનું પ્રથમ એવું બંદર છે જે વેરી લાર્જ કન્ટેનર શીપ (વીએલસીએસ)ને હેન્ડલ કરવાનું કામ પાર પાડી શકાય તેવી સવલત વિકસાવી રહ્યું છે.

જીપીએલના મેનેજિંગ ડિરેક્ટર જેકોબ ફીલ્સે જણાવ્યું કે, જીપીએલના સંચાલક મંડળે વીએલસીએસ જેટી વિકસાવવાની કામગીરીને મંજૂરી આપી છે. જેથી કરીને બંદર પર વધારે કાર્ગોનું વહન કરવાનું શક્ય બને. એલપીએલની વધી રહેલી માંગને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, કંપની તાકીદના ધોરણે બીજી જેટી

ઉમેરવાનું આયોજન ધરાવે છે. હાલ પીપાવાવ પોર્ટ પાસે પાંચ જેટી છે. જેમાં બે કન્ટેનર જેટીનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય જેટીમાં બલ્ક-બ્રેક કાર્ગો જેટી અને એક લિક્વિડ જેટીનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું કે, જીપીએલ તેની વેરહાઉસિંગની સવલત બમણી કરવાનું આયોજન ધરાવે છે. એક વર્ષના સમયગાળામાં તેની ક્ષમતા વધારીને ૨૦૦,૦૦૦ ચોરસ ફૂટની કરવામાં આવશે. જીપીએલએ ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી)ને ભાડપટ્ટાની મુદત વધારવાની માંગ કરી છે. જેમાં હાલ જવાબની રાહ જોવાઇ રહી છે. ધારાધોરણો અનુસાર જીએમબી બીજા ૨૦ વર્ષ માટે ભાડપટ્ટાની મુદત વધારી શકે છે.

જેએસડબ્લ્યુ સ્ટીલનું ઉત્પાદન ઓક્ટોબરમાં ૨૫ ટકા વધીને ૧૭.૭૬ લાખ ટન

પીટીઆઇ નવી દિલ્હી, તા. ૧૧

જેએસડબ્લ્યુ સ્ટીલે આજે સ્વતંત્ર સ્ટીલ ઉત્પાદન ઓક્ટોબર ૨૦૨૨ દરમિયાન ૨૫ ટકા વધીને ૧૭.૭૬ લાખ ટન નોંધાવ્યો હતો.

તેનું કૂડ સ્ટીલ ઉત્પાદન ઓક્ટોબર ૨૦૨૧માં ૧૪.૨૫ લાખ ટન હતું, તેમ કંપનીએ એક નિવેદનમાં

જણાવ્યું હતું. ફ્લેટ રોલ્સનું ઉત્પાન ઓક્ટોબર ૨૦૨૨માં ૩૦ ટકા વધીને ૧૦.૪૫ લાખ ટનથી ૧૩.૬૧ લાખ ટન થયું હતું. લોન્ગ રોલ્સ ઉત્પાદન ૧૧ ટકા વધીને ૫.૭૬ લાખ વર્ષની સરખામણીમાં ૩.૭૦ લાખ ટન થયું હતું. ક્ષમતા વધારાશ સપ્ટેમ્બર ૨૦૨૨માં ૮૯ ટકાથી સુધરીને ૯૩ ટકા થઇ હતી.

ડિસીએક્સ સિસ્ટિમ્સના શેરનું ૩૯ ટકા પ્રિમિયમમાં લીસ્ટીંગ

પીટીઆઇ નવી દિલ્હી, તા. ૧૧

ડિસીએક્સ સિસ્ટિમ્સના શેરે રૂ. ૨૦૭ના ઇસ્યુ ભાવ સામે આજે ૩૯ ટકા પ્રિમિયમ સાથે તેનો બજાર પ્રવેશ કર્યો હતો.

શેરે તેનો પ્રવેશ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) પર ઇસ્યુ ભાવથી ૩૯.૬૫ ટકા ઉછળતા રૂ. ૨૮૭માં કર્યો હતો. તે પછીથી ૪૬.૬૭ ટકા ઉછળીને રૂ. ૩૧૬.૬૭ના સ્તરે પહોંચ્યો હતો. શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) પર ૩૯.૨૯ ટકા પ્રિમિયમમાં રૂ. ૨૮૬.૨૫ના સ્તરે ખુલ્યો હતો. શેર પછીથી ૪૭.૩૪ ટકા વધીને રૂ. ૩૦૫ના સ્તરે પહોંચ્યો હતો.

શરુઆતના ટ્રેડ બંને સેક્સ અને નિફિટમાં વધીને ટ્રેડ થયો હતો. કંપનીનું પ્રારંભિક જાહેર ભરણુ (આઇપીઓ) ૬૯.૭૯ ગણુ ભરાયું હતું. ઓફર રૂ. ૧૦૦ કરોડ સુધી વેચાણ માટે અને રૂ. ૪૦૦ કરોડના નવા ઇસ્યુની હતી.

પ્રિકોલ લિમિટેડનો નફો ઉછળીને રૂ. ૪૭.૫૨ કરોડ

પીટીઆઇ કોચિન, તા. ૧૧

પ્રિકોલ લિમિટેડનો સંકલિત નફો જુલાઇ-સપ્ટેમ્બર ૨૦૨૨ ત્રિમાસિક ગાળામાં રૂ. ૪૭.૫૨ કરોડ કરોડ નોંધાયો છે, તેમ કંપનીએ આજે જણાવ્યું હતું. શહેર સ્થિત ઓટોમોટિવ ટેકનોલોજી કંપનીએ પાછલા વર્ષના સમાન સમય ગાળા દરમિયાન રૂ. ૧૪.૬૬ કરોડનો સંકલિત નફો નોંધાવ્યો હતો. કંપનીનો નફો ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા અર્ધવાર્ષિક ગાળામાં સંકલિત નફો રૂ. ૨૦.૬૦ કરોડથી વધીને રૂ. ૬૮.૧૨ કરોડ થયો હતો, તેમ કંપનીએ

રિલાયન્સ કેપિટલે રૂ. ૨૧૫ કરોડનો યોજ્યો નફો નોંધાવ્યો

નાદારી પ્રક્રિયા હેઠળ પસાર થઇ રહેલી રિલાયન્સ કેપિટલે આજે પોટમાથી બહાર આવી હતી અને સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. ૨૧૫.૨૩ કરોડનો સંકલિત યોજ્યો નફો નોંધાવ્યો હતો. નોન બેંકિંગ ફાયનાન્સ કંપનીએ પાછલા વર્ષના સમાન સમય ગાળામાં રૂ. ૧૧૫.૫૬ કરોડની સંકલિત યોજ્યો પોટ નોંધાવી હતી.

જણાવ્યું હતું. સમીક્ષા હેઠળના સમય ગાળા દરમિયાન કુલ સંકલિત આવક રૂ. ૧.૪૦૯.૪૯ કરોડથી વધીને રૂ. ૧.૫૧૬.૪૬ કરોડ થઇ છે. કુલ સંકલિત આવક છ મહિનામાં રૂ. ૧.૭૨૯.૪૧ કરોડથી વધીને રૂ. ૧.૯૬૨.૯૦ કરોડ થઇ છે. રહેજ્યારે અમારુ ધ્યાન આવી મુશ્કેલ સ્થિતિ છતા પ્રાઇક માંગને પુરી પાડવાના અમારા પ્રયત્નો સાથે અમે અત્યાર સુધીની સૌથી ઊંચી ત્રિમાસિક આવક નોંધાવી હતી, તેમ કંપનીના એમડી વિક્રમ મોહને એક નિવેદનમાં કંપનીની નાણાકીય કામગીરી અંગે જણાવ્યું હતું.

AuSom Enterprise Limited												
Regd. Office: - 11-B, New Ahmedabad Industrial Estate, Village: Moraiya, Sarkhej-Bavla Road, Ahmedabad-382 213.												
CIN : L67190GJ1984PLC006746 Phone : +91 79 2642 1422-1499 Fax : +91 79 2656 9898 E-mail: aksom.ael@gmail.com Website: www.ausom.in.												
STATEMENT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE SECOND QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2022 (RS. IN LAKHS)												
Particulars	STANDALONE						CONSOLIDATED					
	Quarter ended		Half Year ended		Year ended	Quarter ended		Half Year ended		Year ended		
	30/09/2022 (Unaudited)	30/06/2022 (Unaudited)	30/09/2021 (Unaudited)	30/09/2021 (Unaudited)	31/03/2022 (Audited)	30/09/2022 (Unaudited)	30/06/2022 (Unaudited)	30/09/2021 (Unaudited)	30/09/2021 (Unaudited)	31/03/2022 (Audited)		
Total Income from Operations	4894.70	169.42	324.13	5064.11	694.42	3407.46	4894.70	169.42	324.13	5064.11	694.42	3364.92
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	350.44	(36.20)	322.04	314.24	524.92	652.72	527.15	105.19	596.69	632.34	772.23	652.72
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	350.44	(36.20)	322.04	314.24	524.92	652.72	527.15	105.19	596.69	632.34	772.23	652.72
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	296.44	(36.20)	267.04	260.24	429.92	536.72	473.15	105.19	541.69	578.34	677.23	536.72
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	296.44	(36.20)	267.04	260.24	429.92	537.00	473.15	105.19	541.69	578.34	677.23	537.00
Equity Share Capital	1362.36	1362.36	1362.36	1362.36	1362.36	1362.36	1362.36	1362.36	1362.36	1362.36	1362.36	1362.36
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	--	--	---	---	---	10293.72	---	---	---	---	---	10293.72
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) Basic & Diluted:	2.18	(0.27)	1.96	1.91	3.16	3.94	3.47	0.77	3.98	4.25	4.97	3.94

Notes:- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the stock exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter/Annual Financial Results are available on the stock exchange websites at www.bseindia.com, www.nseindia.com and on company's website www.ausom.in.

Place: Ahmedabad
Date : 11/11/2022

For AUSSOM ENTERPRISE LIMITED
KISHOR P. MANDALIA
MANAGING DIRECTOR

GILLANDERS ARBUTHNOT AND COMPANY LIMITED												
Registered Office : C-4, Gillander House, Netaji Subhas Road, Kolkata-700 001												
CIN : L51909WB1935PLC008194												
Phone : (033) 2230 2331 (6 lines), Fax : (033) 2230 4185, E-mail : gillander@gillandersarbuthnot.com , Website : www.gillandersarbuthnot.com												
EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER 2022 (₹ in Lakhs)												
Particulars	STANDALONE						CONSOLIDATED					
	Quarter Ended		Half Year Ended		Year Ended	Quarter Ended		Half Year Ended		Year Ended		
	30-Sep-22 (Unaudited)	30-Jun-22 (Unaudited)	30-Sep-21 (Unaudited)	30-Sep-22 (Unaudited)	30-Sep-21 (Unaudited)	31-Mar-22 (Audited)	30-Sep-22 (Unaudited)	30-Jun-22 (Unaudited)	30-Sep-21 (Unaudited)	30-Sep-22 (Unaudited)	30-Sep-21 (Unaudited)	31-Mar-22 (Audited)
1 Total Income from Operations	14,120.32	11,004.46	12,213.78	25,124.78	18,113.38	36,840.63	14,356.32	12,481.09	12,986.61	26,837.41	20,087.17	40,640.71
2 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	2,572.62	570.47	2,018.25	3,143.09	2,206.30	1,330.05	2,052.84	(319.42)	1,550.57	1,733.42	1,546.96	1,147.44
3 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	2,572.62	1,635.13	2,018.25	4,207.75	2,206.30	1,330.05	2,052.84	745.24	1,550.57	2,798.08	1,546.96	1,147.44
4 Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	2,328.51	1,570.93	1,887.53	3,899.44	2,075.58	1,390.64	1,808.73	681.04	1,419.85	2,489.77	1,416.24	1,634.00
5 Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	2,217.83	1,599.13	2,042.14	3,816.96	2,176.82	1,522.89	1,960.98	(147.10)	1,531.66	1,813.88	1,452.67	1,720.78
6 Paid-up Equity Share Capital (Face Value of ₹ 10/- each)	2,134.23	2,134.23	2,134.23	2,134.23	2,134.23	2,134.23	2,134.23	2,134.23	2,134.23	2,134.23	2,134.23	2,134.23
7 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year						23,035.04						24,850.15
8 Earnings Per Share (of ₹ 10/- each):- Basic & Diluted (not annualised)	10.91	7.36	8.84	18.27	9.73	6.52	8.47	3.19	6.65	11.67	6.64	7.66

Notes :

- The above is an extract of the detailed format of Quarterly and year end financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and year end financial results are available on the websites of NSE and BSE at www.nseindia.com and www.bseindia.com respectively and on the Company's website at www.gillandersarbuthnot.com
- Previous year / period figures have been regrouped/ rearranged, wherever necessary.

By Order of the Board
For Gillanders Arbuthnot and Company Limited
Mahesh Sodhani
(Managing Director)
DIN : 02100322

Place : Kolkata
Date : 11th November, 2022

દલેક્ટ્રોનિકા ફાયનાન્સ લીમિટેડ

ઓડિટ નં. ૧૦૧/૧, એસડબ્લ્યુ. ડી. ઠેલકર રોડ, પુણે-૪૧૧૦૦૪, મહારાષ્ટ્ર, ભારત.

સિઓસીટી ઇન્ફર્મેશન ટેકનોલોજી લિમિટેડ, ૨૦૦૨, (નિયમ) ના નિયમ ૩ સાથે યંત્રીક સિઓસીટી ઇન્ફર્મેશન અને સેફ્ટગ્રાન્ટ સર્વિસ

SHILP GRAVURES LIMITED													
Regd. Office: 778/6, Pramukh Industrial Estate, Sola-Santaj Road, Village Rakanpur, Tal. Kalol, Dist. Gandhinagar, Gujarat - 382 722, India.													
Ph. No.: 02764 - 286323/24, Fax No.: 02764 - 286335 Website: www.shilpgravures.com Email: purvipatel@shilpgravures.com ; CIN: L27100GJ1993PLC020552													
STATEMENT OF FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2022 (Rs. In Lakhs)													
Sr. No.	Particulars	Standalone						Consolidated					
		Quarter ended		Half Year ended		Year ended	Quarter ended		Half Year ended		Year ended		
		30.09.2022 (Unaudited)	30.06.2022 (Unaudited)	30.09.2021 (Unaudited)	30.09.2021 (Unaudited)	31.03.2022 (Audited)	30.09.2022 (Unaudited)	30.06.2022 (Unaudited)	30.09.2021 (Unaudited)	30.09.2021 (Unaudited)	31.03.2022 (Audited)		
1	Total Income	2036.25	2,005.24	1916.09	4041.49	3709.13	7,172.88	2316.11	2235.37	2099.90	4551.48	4054.39	7,851.24
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	424.12	171.94	332.57	596.06	653.30	1,116.18	436.87	178.22	303.58	615.09	604.15	1,006.54
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	424.12	171.94	332.57	596.06	653.30	1,116.18	436.87	178.22	303.58	615.09	604.15	1,006.54
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	383.64	80.54	254.52	464.18	550.32	870.04	393.57	83.73	233.30	477.29	514.52	791.18
5	Total Comprehensive income for the periods	385.23	85.00	262.87	470.23	556.57	888.96	395.16	88.19	241.65	483.34	520.77	805.02
6	Equity share capital (Face Value of Rs 10.00/- each)	614.98	614.98	614.98	614.98	614.98	614.98	614.98	614.98	614.98	614.98	614.98	614.98
7	Reserve and Surplus	-	-	-	-	-	7,534.18	-	-	-	-	-	7,399.85
8	Earnings Per Share (EPS) (of Rs. 10 Each) (Not annualized for Quarters)												
i	a) Basic and Diluted	6.24	1.31	4.14	7.55	8.95	14.15	6.40	1.36	3.79	7.76	8.73	12.87
ii	b) Basic and Diluted	6.24	1.31	4.14	7.55	8.95	14.15	6.40	1.36	3.79	7.76	8.73	12.87

Note:

- The above unaudited standalone / consolidated financial results for the quarter and half year ended 30th September 2022 have been reviewed by the Audit committee and subsequently approved by the Board of Directors in their respective meetings held on 10th November 2022. These unaudited standalone / consolidated financial results have been subjected to Limited review by the statutory auditors of the company. The statutory auditors have expressed an unmodified conclusion.
- The above Standalone and Consolidated Financial Results have been prepared in accordance with the guidelines issued by the Securities and Exchange Board of India ("SEBI") and the Indian Accounting Standards (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013.
- The Company has not elected to exercise its option permitted U/S 115BAA of the Income tax act, 1961 and provision of current tax has been made as per the normal provisions of the Income Tax Act, 1961 and rules frame there under.
- Other income includes net gain arising on sale of investment Rs. 30.99 Lacs and Rs. 117.03 Lacs for the half year ended 30th September 2022 and 30th September 2021 respectively and net gain arising on investments measured at FVTPL amounting Rs. NIL and Rs. 158.78 Lacs for the half year ended on 30th September 2022 and 30th September 2021 respectively. Further, Other expenses includes loss arising on investment measured at FVTPL Rs. 52.84 Lacs and Rs. NIL for the half year ended on 30th September 2022 and 30th September 2021 respectively.
- The Figures of previous periods have been regrouped / reclassified, wherever necessary, to make them comparable.
- The Code on Social Security 2020 (Code) relating to employee benefits during the employment and post employment benefits received Presidential accent in September 2020. The Code has been published in official gazette of India. The effective date from which the Code is applicable yet not notified. The Company will assess the impact of the Code when it comes to effects and will record any related impact in the period of the Code become effective.
- As per requirements of Regulation 33 of the Securities and Exchange Board of India, the Company is required to publish financial results. The financial results are available for perusal on the Company's website www.shilpgravures.com as well as on the stock exchange websites www.bseindia.com.

Place: Rakanpur
Date: 10th November, 2022

For, Shilp Gravures Limited
Sd/-
Mr. Ambar Patel
Managing Director
(DIN: 00050042)